

Departure of Indian Air Force special flight carrying medical assistance to Wuhan, China

February 26, 2020

ચીનનાં વુહાન માટે તબીબી સહાયતા લઈ જતી ભારતીય એર ફોર્સની વિશેષ ફ્લાઈટનું પ્રસ્થાન ફેબ્રુઆરી 26, 2020

માસ્ક, ગ્લોવ્ઝ અને આપાત્તકાલિન તબીબી સાધનો ધરાવતી આશરે 15 ટન તબીબી સહાયતા સાથે ભારતીય એર ફોર્સની વિશેષ ફ્લાઈટ 26 ફેબ્રુઆરી 2020 નાં રોજ ચીનનાં વુહાન તરફ જવા રવાના થયું હતું.

આ સહાયતા ચીનમાં કોરોના વાઈરસ (કોવિડ 19) મહામારી ફેલાવાનાં સંદર્ભમાં અને માસ્ક તથા તબીબી સાધનો જેવા પૂરવઠાઓ પ્રદાન કરવા માટે ચીનની વિનંતી પર પ્રદાન કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 ફેબ્રુઆરી 2020 નાં રોજ રાષ્ટ્રપતિ શ્રી ઝિનપિંગને લખ્યું હતું જેમાં ભારતનાં લોકો અને ભારત સરકારની ચીનનાં લોકો અને સરકાર તરફનો ઐક્ય ભાવ અભિવ્યક્ત કર્યો હતો અને જરૂરિયાતનાં આ સમયમાં ચીનને ભેંટ તરીકે સહાયતા પણ અર્પણ કરી હતી. તબીબી પૂરવઠાઓ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જાહેર આરોગ્ય આપાત્તકાલિન તરીકે ઘોષિત કરવામાં આવેલા આ ચેપનાં ફેલાવાને નિયંત્રિત કરવાનાં ચીનનાં પ્રયાસોમાં વધારો કરવામાં મદદ કરશે.

બન્ને દેશો આ વર્ષે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70 વર્ષગાંઠ પણ ઉજવે છે તે સાથે આજે મોકલવામાં આવી રહેલી સહાયતા ભારતનાં લોકોની ચીનનાં લોકો તરફની મૈત્રી અને એકતાને પણ અંકિત કરે છે.

ભારતીય એર ફોર્સની આ ફ્લાઈટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પારોશીઓને પ્રાથમિકતાની નીતિનાં અનુપાલનમાં ભારત આવવામાં સહાયતાની મદદ માંગી છે તેવા કેટલાક ભારતીયો અને વિદેશી નાગરિકોને પારોશી દેશોમાંથી ભારતમાં પાછા લાવશે.

નવી દિલ્હી
ફેબ્રુઆરી 26, 2020

DISCLAIMER : This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.